



19th July, 2021

BSE Ltd.

P.J. Towers, Dalal Street Mumbai-400 001

Code:502180

National Stock Exchange of India Ltd.

Exchange Plaza, Bandra-Kurla Complex, Bandra(East) Mumbai-400 051

Code: SHREDIGCEM

Dear Sir,

Sub: Publication/Advertisement in Newspapers for intimation to the Board Meeting of Shree Digvijay Cement Company Limited (the Company) for considering the Unaudited Financial Results for the Quarter ended June, 2021.

In terms of provisions of Regulation 47 of SEBI (Listing Obligations and Disclosure Requirements) Regulations, 2015, a notice of the Board Meeting is scheduled on 29.07.2021, to consider and approve the Unaudited Standalone & Consolidated Financial Results for the quarter ended 30th June, 2021 of the Company, has been published in Financial Express (all India edition -English) and Financial Express Gujarati on 17th July, 2021 by the Company.

Copies of the same is attached for your information and records.

Thanking you, Yours truly,

For Shree Digvijay Cement Company Limited

Suresh Meher

VP (Legal) Company Secretary

Encl.: As-above

Shree Digvijay Cement Company Limited

CIN: L26940GJ1944PLC000749 CIN: L26940GJ1944PLC000749

Digvijaygram, Jamnagar – 361 140 (Gujarat)

Email: investors.sdccl@digvijaycement.com Website: www.digvijaycement.com Phone 0288-2344272-75 , Fax No. 0288-2344092

NOTICE

Pursuant to Regulation 29 read with the Regulation 47 of the SEBI (Listing Obligations and Disclosure Requirements) Regulations 2015, as amended from time to time. Notice is hereby given that a meeting of the Board of Directors of the Company will be held on Thursday, 29th July, 2021, inter-alia, to consider and approve the Unaudited Standalone & Consolidated Financial Results of the Company for the quarter ended 30th June, 2021.

This Notice is also available at Investors Section of the Company's website www.digvijaycement.com and on the Stock Exchanges website at www.bseindia.com and www.nseindia.com, where the shares of the Company are listed

For Shree Digvijay Cement Company Limited

Place: Digvijaygram Date: 15th July, 2021

Suresh Meher VP (Legal) & Company Secretary

D*Mart AVENUE SUPERMARTS LIMITED

Registered Office: Anjaneya CHS Limited, Orchard Avenue, Opp. Hiranandani Foundation School, Powai, Mumbai - 400 076 Corporate Office: B-72/72A, Wagle Industrial Estate, Road No. 33, Kamgar Hospital Road, Thane - 400604

Tel No.: +91-22-3340 0500, +91-22-7123 0500 | Fax: +91-22-3340 0599 Website: www.dmartindia.com | Email Id: investorrelations@dmartindia.com CIN: L51900MH2000PLC126473

NOTICE OF THE 21st Annual General Meeting to be held through video CONFERENCING (VC)/ OTHER AUDIO VISUAL MEANS (OAVM)

Notice is hereby given that 21st Annual General Meeting ("AGM") of the Members of Avenue Supermarts Limited ('the Company') will be held on Tuesday, 17th August. 2021 at 11:00 A.M. IST through VC/OAVM in compliance with all the applicable provisions of the Companies, Act, 2013 and rules made thereunder and the Securities Exchange Board of India (Listing Obligation and Disclosure Requirements) Regulations, 2015, read with Circular No. 14/2020 dated 8th April, 2020, Circular No. 17/2020, dated 13th April, 2020, Circular No. 20/2020 dated 5th May, 2020 and Circular No. 02/2021 dated 13th January, 2021 issued by Ministry of Corporate Affairs (collectively referred as 'MCA Circulars') to transact businesses set out in the Notice of AGM. Members will be provided with a facility to attend the AGM through VC/OAVM. 1. Dispatch of Notice of AGM and Annual Report:

In compliance with the MCA Circulars and Circular No. SEBI/HO/CFD/CMD1/CIR/P/2020/79 dated 12th May, 2020 and Circular No. SEBI/HO/CFD/CMD2/CIR/P/2021/11 dated 15th January 2021 issued by SEBI (collectively referred to as "the Circulars"), Notice of AGM along with the Annual Report 2020-21 will be sent only through electronic mode to those Members whose e-mail addresses are registered with the Company's Registrar and Share Transfer Agent/ Depositories. The Notice and Annual Report 2020-21 will also be available on the Company's website www.dmartindia.com, websites of the Stock Exchanges i.e. BSE Limited and National Stock Exchange of India Limited at www.bseindia.com and www.nseindia.com respectively and on the website of NSDL at www.evoting.nsdl.com.

2. Manner of registering/updating e-mail address:

Members holding shares in dematerialized mode, who have not registered/ updated their e-mail address, are requested to register/ update the same with the Depository Participant(s) where they maintain their demat accounts. Members holding shares in physical mode, who have not registered/ updated their e-mail address, are requested to register/update the same by writing to the Company with details of folio number, e-mail address and attaching a self-attested copy of PAN card at investorrelations@dmartindia.com or to Link Intime (India) Private Limited at rnt.helpdesk@linkintime.co.in.

. Manner of casting votes through e-voting:

The Company has availed services of NSDL for providing remote e-voting facility to its Members to cast their votes on all resolutions set out in the Notice of the AGM. Additionally, the Company is providing facility of e-voting during the AGM for Members who have not cast their votes through remote e-voting. The manner for remote e-voting/ voting during the AGM by Members holding shares in dematerialized mode, physical mode and for Members who have not registered their e-mail address has been provided in the Notes to Notice of the AGM.

Members are requested to carefully read all the Notes set out in the Notice of the AGM and in particular, instructions for joining the AGM, manner of casting votes though remote e-voting and e-voting during the AGM.

By Order of the Board of Directors For Avenue Supermarts Limited Mrs. Ashu Gupta

Place: Thane Date: 16.07.2021

Company Secretary & Compliance Officer

NOTICE OF THE 27TH ANNUAL GENERAL MEETING, POST DISPATCH OF NOTICE & ANNUAL REPORT

Notice is hereby given that the Twenty Seventh Annual General Meeting (27th AGM) of the Members of the Company will be convened on Saturday, the 7th August, 2021 a 11:00 A.M. through Video Conferencing ('VC')/Other Audio-Visual Means ('OVAM') facility in compliance with the applicable provisions of Companies Act, 2013 read along with MCA General Circular No. 14/2020, 17/2020 and 20/2020 dated 8th April, 2020, 13th April, 2020 and 05th May, 2020 respectively and SEBI (Listing Obligations and Disclosure Requirements) Regulations, 2015 ('Listing Regulations') read along with applicable circulars.

The Members of the Company are hereby informed, in terms of section 108 of the Companies Act, 2013 read with Rule 20 of the Companies (Management and Administration) Rules, 2014 and Regulation 44 & 47 of the Listing Regula Secretarial Standards on General Meetings issued by ICSI, that the notice of the 27th AGM of the Company setting out the businesses to be transacted along with Explanator ment and the Annual Report of the Company for the financial year ended on 31s March, 2021 have been sent in electronic mode to the Members whose email IDs are registered with the Company or the Depository Participant. Please note that by virtue of the MCA circulars and SEBI circular and considering the current pandemic scenario, th requirement of sending physical copies of Notice and Annual Report has been dispensed with. Accordingly, the Company is facilitating the Notices and Annual Report to the Members of the Company only in electronic form. The electronic dispatch of the Notice and Annual report has been completed on 16th July, 2021. The copy of Notice of AGM along with Annual Report of the Company is also made available on the website of the Company at www.smcindiaonline.com, and on the website of Company's Registrar and Transfer Agent, Link InTime India Private Limited at https://instavote.linkintime.co.in. The details pertaining to AGM and e-voting process is appended below:

- 1. The cut-off date to determine the eligibility of the members holding shares eithe in physical or dematerialized form to cast votes at AGM is 31st July, 2021. In this regard, person whose name is recorded in the Register of Members or in the Register of Beneficial Owners maintained by the depositories as on 31st July, 2021 shall only be entitled to avail the facility of remote e-voting or electronic voting at the AGM.
- 2. The remote e-voting period shall commence on Sunday, 4th August, 2021 at 9:00 A.M. and ends on Tuesday, 6th August, 2021 at 5:00 P.M. The remote e-voting shall be disabled after the stipulated time. Members who have voted through remote e-voting shall be eligible to attend the AGM; however, they shall not be eligible to vote at the Meeting. Once, the vote on a resolution is casted by the member, the same cannot be modified subsequently.
- Members attending the AGM who have not cast their vote by remote e-voting shall be eligible to cast their vote through electronic voting or insta-vote during the neeting, in the manner as provided in the Notice of AGM.
- 4. Members who are holding shares in physical form and those persons who acquires and becomes shareholder of the Company after the dispatch of the Notice of AGM and holding shares as on the cut-off date i.e. 31st July, 2021 can opt for e-voting by obtaining the login ID and password by sending an email to enotices@linkintime.co.in or contact on: - Tel: 022-4918 6000.
- 5. The procedure of electronic voting i.e. both remote e-voting and e-voting at AGM is provided in the Notice of AGM.

For detailed instructions pertaining to remote e-voting and insta-voting at the AGM members may please refer to the section "Notes" in the Notice of the Annual General Meeting. In case shareholders/ members have any queries regarding login/ e-voting they may contact Rajeev Ranjan, A.V.P of Link Intime (RTA) by sending an email to nstameet@linkintime.co. in or contact on: - Tel: 022-49186175.

The members who hold shares in physical form and/or who have not yet registered thei email addresses with the Company/RTA/Depository can register and obtain the Notice of AGM and Annual Report and the login details for joining the 27th AGM of the Company through VC/OAVM facility by sending the required documents and information to Link Intime India Pvt. Ltd. at enotices@linkintime.co.in or contact on: - Tel: 022 -49186175. Further, pursuant to the provisions of section 91 of the Companies Act, 2013, the

Members are apprised that the Register of the Members and the Share Transfer Book of the Company will remain closed from 17th July, 2021 till 21st July, 2021. The aforementioned information is being issued for the information and benefit of all the

Members of the Company and is in compliance with MCA circulars and the SEBI circulars. For SMC Global Securities Limited

(Suman Kumar)

E.V.P. (Corporate Affairs) & Company Secretary

Date: 16th July, 2021 Place: New Delhi

Corporate Identity Number (CIN: L74899DL1994PLC063609)

Registered Office: 11/6B, Shanti Chamber, Pusa Road, New Delhi-110005 Ph: +91-11-30111000, 40753333 | Fax: +91-11-25754365 E-mail: smc@smcindiaonline.com | Website: www.smcindiaonline.com





Head Office: Lokmangal, 1501, Shivajinagar, Pune - 411005, Emall: investor_services@mahabank.co.in Website: www.bankofmaharashtra.in

Pursuant to Regulation 29 read with Regulation 47 of the SEBI (Listing Obligations and Disclosure Requirements) Regulations, 2015, Notice is hereby given that a Meeting of the Board of Directors of the Bank will be held on Thursday, the 22nd July 2021 at Pune interalia, to consider and approve the Unaudited Standalone and Consolidated Financial Results of the Bank for the First Quarter ended 30th June, 2021.

The Notice of the Board Meeting is also available on the Bank's website at www.bankofmaharashtra.in and on the website of Stock exchanges i.e. www.bseindia.com and www.nseindia.com

Place : Pune Date : 16/07/2021

(V. P. Srivastava) CFO & General Manager

The Singareni Collieries Company Limited (A Government Company) Regd. Office: KOTHAGUDEM- 507101, Telangana. E-PROCUREMENT TENDER NOTICE

Tenders have been published for the following Services / Materia ocurement through e-procurement platform. For details, please v https://tender.telangana.gov.in - or - https://www.sccimines.com

NIT/Enquiry No. - Description / Subject / Estimated Contract Value - Last date and time for Submission of bid(s)
E142100143- Transportation and Delivering of Bottom Ash from STPP to SRP-1, 3 and 3A and RK-7 Inclines, Srirampur area for a period of two Years -30.07.2021-10:30 Hrs.

50:07-2021-10:30 HIS.

192100014- Hiring of 7.5 KVA, 230V Mobile Diesel Engine Driven Tire nounted Lighting Generators with 10 Meters high mast for three (03) years eriod for the use at various Opencast Projects on Rate Contract Basis-2003 2021, 47:500 Ltd.

3.08.2021-17:00 Hrs

D3.02.2021-17.00 Fils.
E072100139- Procurement of SMF batteries on Rate Contract for a period of 2 years - 04.08.2021-17:00 Hrs.

PAPA/CVIL/ET-18/21-22 — Construction of 11 Kv switch station near punch entry-II in RGOC-II quarry for adriyala long wall project, Adriyala project area-26.07.2021-4:30P.M.

-AddI.GM(Civil)/RG.III area-26.07.2021-4:30P.M. — Addi.GM(Civil)/RG.III

CRP/CVL/COR/TN-28/2021-22. Dt.10.07.2021 — Suppiying laying and ointing of 250 mm dia Dl pipe line (Length:2,250 M (approx.)) for supply o water from Hemachandrapuram filter bed to Hill tank near Central workshog at Kothagudem. Bhadradri Kothagudem Dist. Telangana State-Part-A Rs.5.344/-,Part-B: Rs.17.72,842/-,Part-C: Rate Column blank-03.08.2021-130.PM

CRP/CVL/STPP/TN-33/2021-22, Dt.15.07.2021 - Construction of Swimming pool at STTP, Jaipur, Mancherial Dist, TS-Part-A: Rs.11,80,300/-Part-B: Rs.53,01,042/-,Part-C: Rate Column blank-05.08.2021-4:30 P.M. Part-B: Rs. 53,01,042/-,Part-C: Rate Column blank-05.08.2021-4:30 P.M. CRP/CVL/RG.J/TN-30/2021-0 posity, construction, esting, commissioning of 17 MLD Sewage Treatment Plant based on SBR Fechnology and allied works including comprehensive operation & maintenance for a period of one year (after successful trial run of 6 months) on EPC basis in SCCL township at RG.I Area, Godavarikhani, Peddapalli Dist., Telangana State – Pre-bid meeting will be held on – 22.07.2021 through virtual mode from Head Office, Kothagudem Corporate-12.08.2021-4:30 P.M.

PR/2021-22/MP/CVL/31 DIPR R.O.No.: 1966-PP/CL-AGENCY/ADVT/1/2021-22

MILESTONE GLOBAL LIMITED

MILES I ONE GLOBAL LIMITED
CIN: L93000KA1990PLC011082
Regd. Off: 54-B, Hoskote Industrial Area (KIADB), Chintamani Road,
Hoskote – 562 114, Karnataka, India. Phone Off: 91-80-27971334
Website: www.milestonegloballimited.com
NOTICE OF 31 ANNUAL GENERAL METING
TO BE HELD VIA VIDEO CONFERENCING

- Shareholders may note that the 31st Annual General Meeting (AGM) of the Company will be held over Video Conference on Saturday, 25th day of September, 2021 at 11:00 a.m. IST in compliance with General Circular numbers 20/2020 14/2020, 17/2020, 02/2021 and all other applicable laws and circulars issued by the Ministry of Corporate Affairs (MCA), Government of India and the Securities and Exchange Board of India (SEBI), to transact the business that will be set forth in the Notice of AGM.
- 2. In compliance with the above circulars, electronic copies of the Notice of AGM and the Annual Report for the financial year 2020-2021 will be sent to all those shareholders whose email addresses are registered with the Company's RTA/Depository Participant(s). Shareholders holding shares in dematerialized mode are requested to register their email addresses and mobile numbers with their relevant depositories through their depository participant(s). Shareholders holding shares in physical mode are requested to furnish their email addresses and mobile numbers with the Company's RTA "Integrated Registry Management Services Private Limited" at irg@integratedindia.in. The notice off the 31st AGM will also be made available to the Company's Website www.milestonegloballimited.com, stock exchange and CDSL at https://www.evotingindia.com.
- Shareholders will have an opportunity to cast their vote remotely on the business as set forth in the Notice of AGM through electronic voting system. The manner of voting remotely for shareholders holding shares in dematerialized mode, physical mode and for shareholders who have not registered their email addresses will be provided in the Notice of AGM.
- The notice of the 31st AGM will be sent to the shareholders in accordance with the applicable laws on their registered email addresses in due course.

For Milestone Global Limited

Anita Rawat Company Secretary



Persistent

Date: 17th July, 2021 Place: Bangalore

Persistent Systems Limited CIN: L72300PN1990PLC056696

Regd. Office: Bhageerath, 402 Senapati Bapat Road, Pune 411 016 Ph. No.: +91 (20) 6703 0000; Fax: +91 (20) 6703 0008 E-mail: Investors@persistent.com; Website: www.persistent.com

ADDENDUM TO THE NOTICE OF THE THIRTY-FIRST ANNUAL GENERAL MEETING OF THE MEMBERS OF PERSISTENT SYSTEMS LIMITED TO BE HELD ON WEDNESDAY, JULY 21, 2021 AT 1600 HRS. (INDIA TIME) THROUGH VIDEO CONFERENCING ("VC")/OTHER AUDIO-VISUAL MEANS ("OAVM")

Dear Shareowner

Persistent Systems Limited (the "Company") has issued a notice dated June 10, 2021 ("Notice of the AGM") for convening the THIRTY-FIRST Annual General Meeting of the Members of the Company to be held on Wednesday, July 21, 2021 at 1600 Hrs. (India Time) through Video Conferencing ("VC")/Other Audio Visual Means ("OAVM"). The Notice of the AGM has been dispatched to the Members on June 23, 2021 in due compliance with the provisions of the Companies Act, 2013 read with the relevant rules

The Item Nos. 6 and 7 of the Special Businesses from the Notice of the AGM pertain to seeking an approval of the Members for the amendments in the 'Persistent Employee Stock Option Scheme 2014' ("PESOS 2014"). In the Explanatory Statement of Notice of the AGM, the 'Point No.' (f) of the Proposed amendment no. 3.' contains the information on determining the exercise price per option granted under PESOS 2014. The same was maintained in line with the earlier original disclosure made by the Company at the time of initial approval of the Members by way of Special Resolu dated July 26, 2014. We wish to reiterate that the same is in due compliance of the prevailing provisions of the Companies Act, 2013 and that of the then prevailing ecurities and Exchange Board of India (Employee Stock Option Scheme and Employee Stock Purchase Scheme), Guidelines, 1999 ("SEBI ESOP Guidelines") read with the now prevailing Securities and Exchange Board of India (Share Based Employee Benefits) Regulations, 2014 read with circulars issued thereunder ("SEBI SBEB Regulations").

However, with a view to enable the Members to take an informed decision while exercising their voting rights, the Company considers it more appropriate to add clarity to the original disclosure on the Exercise price or pricing formula as part of the Explanatory Statement with respect to Item No. 6 and 7 of the Notice of the AGM by way of an amendment to the disclosure. Accordingly, the Members are requested to

kindly take note of this amendment to the disclosure in the Explanatory Statement. This addendum to the Notice of the AGM ("Addendum") shall form an integral part of the Notice of the AGM which has already been circulated to the Members of the Company and on and from the date hereof, the Notice of the AGM shall always be read in conjunction with this Addendum. This Addendum will also be available on the website of BSE Ltd. (www.bseindia.com), the National Stock Exchange of India Ltd. (www.nseindia.com) and on the website of the Company (https://www.persistent.com/wp-content/uploads/2021/07/Addendum-to-the-AGM-

Notice.pdf) All other contents of the Notice of the AGM including the Special Resolutions as proposed in Item No. 6 and 7, save and except as modified or supplemented by this Addendum, shall remain unchanged.

Addendum to the Explanatory Statement for Item No. 6 and 7 of the Notice of the AGM:

As a change to the information under Point No. (f) of the Explanatory Statement for Item Nos. 6 and 7 of the Special Businesses, on Page No. 25 of the Notice of the AGM regarding Exercise price or pricing formula under the Features of the PESOS 2014 the explanation on Point No. (f) of the Proposed amendment no. 3 for PESOS 2014 shall be substituted as under.

Existing Disclosure: PESOS 2014: The exercise price per Option shall be decided by the Board / Committee from time to time.

"PESOS 2014: The Exercise Price shall be equal to the face value of shares i.e. INR 10 per option."

Consent of the members is being sought by way of special resolutions pursuant to Section 62(1)(b) and all other applicable provisions, if any, of the Companies Act, 2013 and as per Regulations 6 and 7 of the SEBI SBEB Regulations. None of the Directors, Key Managerial Personnel of the Company including their

relatives are interested or concerned in this resolution, except to the extent they may be lawfully granted options under PESOS 2014. The Board of Directors recommends the resolutions at Item Nos. 6 and 7 for the approval of the Members as Special Resolutions.

In light of above, you are requested to accord your approval to the Special Resolutions as set out at Item Nos. 6 and 7 of the Notice of the AGM. By the order of the Board of Directors

Date : July 16, 2021

Amit Atre ICSI Membership No.: ACS 20507

For Persistent Systems Limited

Crompton

Crompton Greaves Consumer Electricals Limited
CIN: L31900MH2015PLC262254

Registered & Corporate Office: Tower 3, 1* Floor, East Wing, Equinox Business Park,
LBS Marg, Kurla (West), Mumbai 400070, India
Tel.: +91-22-6167 8499 Fax: +91-22-6167 8383

E-mail: crompton investoring teleproceptions on in Website: www.crompton.co.in

orrelations@crompton.co.in Website: www.crompton.co.in

CORRIGENDUM

Board Report for the Financial Year ended 31* March, 2021

This has reference to the Board Report forming part of the Annual Report for the financial year ended 31st March, 2021 of Crompton Greaves Consumer Electricals Limited ("Company"). We would like to inform that the para (a) under page no. 57 of the Board Report in relation to the Statutory Auditors shall be substituted and replaced by the following:

"The Company's Statutory Auditors, M/s Sharp & Tannan, Chartere Accountants, (ICAI Firm Registration No. 10982W) who were appointed with your approval at the 2" AGM for a period of five years, will complete their presenterm on conclusion of the ensuing 7" AGM of the Company.

After issuance of the Notice for convening the 7th AGM, the Company has received a letter dated 14th July, 2021 from M/s Sharp & Tannan, Chartered Accountants, withdrawing their consent to be re-appointed as Statutory Auditors

of the Company.

In order to avoid any controversy arising from differing legal views about their eligibility for re-appointment and to uphold their high governance standards, M/s Sharp & Tannan, Statutory Auditors vide their letter dated 14th July, 2021 to the Company, have withdrawn their consent to be re-appointed as Statutory Auditors of the Company. The Audit Committee noted that the withdrawal of consent was due to the reasons stated above and not due to any other concern or issue.

We wish to further inform you that based on the recommendation of the Audit Committee, the Board of Directors of the Company at its meeting held on 15° July, 2021 noted and accepted the withdrawal of consent by M/s Sharp & Tannan for

The Auditors i.e M's Sharp & Tannan, Chartered Accountants have issued an unmodified opinion on audited financial statements of the Company for the year ended 31st March, 2021. The Report given by them on the financial statements of the Company is part of the Annual Report.

During the year under review, there were no material or serious instances of fraud falling within the purview of Section 143 (12) of the Companies Act, 2013 and rules made thereunder, by officers or employees reported by the Statutory Auditors of the Company during the course of the audit conducted and therefore no details are required to be disclosed under Section 134 (3) (ca) of the Act.

The Audit Committee and the Board at their respective meetings placed on record their appreciation of the contribution of the audit services of M/s Sharp & Tannan to the Company."

The corrigendum is available on the website of the Company at https://www.crompton.co.in/investors/annual-report/ and is being sent to the Stock Exchanges. Yours sincerel

Pragya Kau

Date : July 16, 2021 Company Secretary & Compliance Office

UDAIPUR CEMENT WORKS LIMITED

(CIN: L26943RJ1993PLC007267)

Regd. Office: Shripati Nagar, CFA, P.O.: Dabok,
Udaipur-313 022 (Rajasthan)

Secretarial Office: Gulab Bhawan, 3rd Floor,
6A, Bahadur Shah Zafar Marg, New Delhi-110 002

NOTICE OF THE 25th ANNUAL GENERAL MEETING, **E- VOTING AND BOOK CLOSURE INFORMATION**

The 25th Annual General Meeting of the Members of the Company will be held on Thursday, the 19th August 2021 at 12:00 Noon, Indian Standard Time, (AGM) through Video Conferencing (VC)/ Other Audio Visual Means (OAVM) in compliance with all the applicable provisions of the Companies Act, 2013 (Act) and the Rules made thereunder and the SEBI (Listing Obligations and Disclosure Requirements) Regulations. 2015 read with all the applicable circulars on the matter issued by the Ministry of Corporate Affairs (MCA) and Securities and Exchange Board of India (SEBI) to transact the business as set out in the Notice convening the AGM. The procedure for attending the AGM through VC/ OAVM is well explained in Note No. 8 of the Notice of AGM, Members participating in the AGM through VC / OAVM facility shall be reckoned

In compliance with the aforesaid circulars, the Annual Report for the Financial Year 2020-21 containing the Financial Statements, Report of Directors and Auditors thereon and other documents required to be attached thereto and the Notice convening the AGM have been sent to the Members of the Company and other persons so entitled, whose E-mail addresses are registered with the Company/ Registrar and Share Transfer Agent: MCS Share Transfer Agent Ltd., New Delhi (RTA) or Depository Participants (DP) on 15th July 2021. The aforesaid documents are also available and can be downloaded from the website of Company at www.udaipurcement.com and at the website of the Stock Exchange, i.e. BSE Ltd. www.bseindia.com.

Book Closure: The Register of Members and Share Transfer Books of he Company will remain closed from 13th August 2021 to 19th Augus 2021 (both days inclusive) for the purpose of AGM.

E-voting: The Company is providing to its Members, holding Equity Shares either in physical or dematerialized form as on Thursday, 12th August 2021 (Cut-off Date), the facility to exercise their right to vote by electronic means, in the following manner, in respect of the resolutions proposed to be passed at the AGM, through e-voting services

- Wednesday, 18th August 2021 (5.00 P.M.) The remote e-voting shall not be allowed beyond the said date and time.
- cast their vote by remote e-voting and are attending the AGM through VC or OAVM.

(B) E-voting at the AGM: The facility for e-voting shall also be

the Register of Beneficial Owners maintained by the Depositories, as on the Cut-off Date, only shall be entitled to avail the facility of remote e-voting or e-voting at the AGM.

Members holding shares in dematerialized mode, physical mode and for Members who have not registered their E-mail addresses and information, instructions and procedure relating to Login ID and Password for e-voting, are provided in the Notice of AGM which is also available on the website of CDSL at www.evotingindia.com.

e-voting, prior to the date of AGM, may also attend the AGM through VC or OAVM, but shall not be entitled to vote again at

after the Notice has been sent electronically and holds Equity Shares as on the Cut-off date, may generate the Login ID and Password by following the procedure for e-voting as mentioned in the Notice of AGM. However, if the Member is already registered with CDSL for e-voting, such Member can use the existing Login details for casting the vote

Manner of registering/updating E-mail addresses by the Members:

- (A) Shares held in Physical Mode: Please send an email
- (B) Shares held in Demat Mode: Please contact your DP with whom you maintain your Demat Account to register your Email address and mobile no.

the procedure for obtaining their login credentials to their registered

Any grievances connected with the facility for voting by electronic means may be addressed to Mr. Rakesh Dalvi, Manager, Central Depository Services (India) Limited, A Wing, 25th Floor, Marathon Futurex, Mafatlal Mill Compounds, N M Joshi Marg, Lower Parel (East), Mumbai - 400013 or send an email to helpdesk.evoting@cdslindia.com or call on 022-23058542/43. Please write to the Company for any assistance.

For Udalpur Cement Works Limited

Poonam Singh

Company Secretary

Date: 16th July 2021 Place: New Delhi

WUCWL UDAIPUR CEMENT WORKS LIMITED

Crompton

Crompton Greaves Consumer Electricals Limited CIN: 1.31900MH2015PLC262254

Registered & Corporate Office: Tower 3, 1* Floor, East Wing, Equinox Business Park,
LBS Marg, Kurla (West), Mumbai 400070, India

Tel.: +91-22-6167 8499 Fax: +91-22-6167 8383

CORRIGENDUM

NOTICE OF ANNUAL GENERAL MEETING | 23rd JULY 2021 This has reference to the Notice dated 24th June, 2021 convening 7th Annual General Meeting ("AGM") of Crompton Greaves Consumer Electricals Limited ("Company") to be held on Friday, 23th July, 2021 at 3.00 PM through video conferencing/other audio-visual means at Tower 3, 1th Floor, East Wing, Equinox Business Park, LBS Marg, Kurla (West), Mumbai 400 070 ("Deemed Venue of the Meeting").

Venue of the Meeting"). With reference to resolution item no. 3 in relation to "Re-appointment of M/s Sharp & Tannan, Chartered Accountants, Statutory Auditors of the Company and to fix their remuneration", the Company has received a letter dated 14" July, 2021 from M/s Sharp & Tannan, Chartered Accountants withdrawing their consent for re-appointment as Statutory Auditors of the Company. The Board has accepted the said withdrawal and consequently the proposed resolution item no. 3 for re-appointment of Statutory Auditor stands withdrawn and will not be transacted upon during the forthcoming AGM.

This corrigendum to the notice of the AGM shall form an integral part of the AGM notice dated 24th June, 2021. Accordingly, Registrar and Share Transfer Agent, depositories, Shareholders, agencies appointed for e-Voting, and other concerned authorities and persons are requested to take note of the withdrawal of the resolution item no. 3 along with the explanatory statement.

The corrigendum is available on the website of the Company at https://www.crompton.co.in/investors/stock-exchange-filings/ and on https://www.crompton.co.in/investors/annual-report/ and is being sent to the Stock Exchanges.

Yours sincerely For Crompton Greaves Consumer Electricals Limite

Pragya Kaul

Date: 16.07.2021

CGM (Materials)

Date : July 16, 2021 Company Secretary & Compliance Officer

Place: Mumbai

Tender No. HQMM/2011-20/51X062/392

31.07.2021 at 11.00 AM through

Microsoft Teams. mail)



Open Tender Notice (E-Procurement Mode Only)

E-tenders are invited for following items from reputed manufacturers

directly or through their dealers / accredited agents through MSTC portal

website https://www.mstcecommerce.com/eprochome/nmdc/buyer_login.jsp.						
Description of Equipment	Qty (NO)	Display of Tender Documents Period	Last date & Time for submission of Final offer			
Design, Manufacture, Supply, Installation, Testing & Commissioning of 3.3KV, 5000KVAR Automatic Power Factor Correction panels (APFC Panels) at Main Substation, Bacheli Complex, Chhattisgarh State. (Prebid Meeting on		Draft Tender: 16.07.2021 to 31.07.2021 FINAL Tender (Tentative) 10.08.2021 To 25.08.2021 upto 2.30 p.m	25.08.2021 by 2.30PM (IST)			

Prospective bidders may visit our websites: www.nmdc.co.in; CPP Portal https://eprocure.gov.in; https://mstcecommerce.com and may download the tender documents. Any comgendum to the above tender notice will be uploaded on our website and MSTC e-portal only.

हर एक काम देश के नाम इस्पाती इरादा

Hero FinCorp Limited

Regd. Office: 34, Community Centre, Basant Lok, Vasant Viher, New Delhi-110057, Corporate Office: 09, Community Centre, Basant Lok, Vasant Vihar, New Delhi-110057 Phone: 011-4948 7150 | Fax: 011-4948 7197-98 eroFinCorp. E-mail: investors@herofincorp.com | Website: www.herofinc

SUB: TRANSFER OF EQUITY SHARES OF THE COMPANY TO IEPP (INVESTOR EDUCATION AND PROTECTION FUND) This notice is published pursuant to the provisions of Section 124(5) and Section 124(6) of the Companies Act, 2013 ("the Act") read along with the Investor Education and Protection Func Authority (Accounting, Audit, Transfer and Refund) Rules, 2016 (IEPF Rules) issued by Ministry of Corporate Affairs and subsequent amendment thereto.

NOTICE (For the attention of Equity Shareholders of the Company)

nistry of Corporate Analis and Subsequent Amendment relect. cordingly, all underlying equity shares in respect of which dividend has not been paid o imed for seven consecutive years or more from financial year 2013-14 (Final Dividend) an juired to be transferred to IEPF Authority as per the Rules. The Company has also sent individual communication to each of the shareholder(s) whose shares are liable to be transferred to DEMAT Account of IEPF Authority. The details of

shares are liable to be transferred to DEMAT Account of IEPF Authority. The details of unclaimed/unpaid dividend and respective shares liable to transferred are available on the website of the Company i.e. www.herofincorp.com under "Investors" section.

Shareholder(s) holding shares in physical form and whose shares are liable to be transferred to IEPF, may please note that the Company would be issuing new share certificates in lieu of the original share certificates held by them for the purpose of conversion into demat form and subsequent transfer to demat account opened by IEPF Authority. Upon such issue, the original share certificates which are registered in their name shall stand automatically cancelled and be deemed non-negotiable. In case of shareholder(s) holding shares in demat form, the transfer of shares to the demat account of IEPF Authority shall be effected by the Company through the respective Depositories by way of Corporate Action.

Company through the respective Depositories by way of Corporate Action.
Pursuant to the IEPF Rules, all the underlying shares in respect of which the dividend has
remained unclaimed/unpaid for seven consecutive years will be transferred to IEPF Authority
by October 19, 2021. In view of the above, all such shareholder(s) are requested to make an
application to the Company's Registrar and Share Transfer Agent (contact details are given in
the last para of this notice) by September 30, 2021 for claiming the unpaid dividend (final) for
the FY 2013-14, so that their shares will not be transferred to the IEPF Authority. It may be
noted that if no claim/application is received by the Company or the Company's Registrar
and Share Transfer Agent by the aforesaid date, the Company will be compelled to transfer
the underlying shares to the IEPF, without any further notice. Shareholder(s) may note that
both the unpaid/unclaimed dividends and the shares transferred to IEPF Bank/ Demat
Account including all benefits accruing on such shares, if any, can be claimed by them from

both the Unpartyuncianned ontends and the Shares, if any, can be claimed by them from IEPF Authority after following the procedure prescribed under the Rules. For claiming unparld/unclaimed dividend, shareholder(s) are requested to contact the Company's Registrar and Share Transfer Agent, Mr Navin Chand at Ms/ Link Intime India Private Limited, Noble Heights, 1st Floor, Plot NH 2, C-1 Block LSC, Near Savitri Market, Janakpuri, New Delhi-110058, Phone: +91 11 49411000 email id:

ce: New Delhi Head- Compliance & Company Secretar Date: 16.07.2021

QUINT DIGITAL MEDIA LIMITED

(FORMERLY KNOWN AS GAURAY MERCANTILES LIMITED) CIN: 174110DI 1985PI C373314 Read Office: 403 Prabhat Kiran, 17, Rajendra Place, Delhi- 110008 | Tel: 011- 45142374

Corporate Office.: Carnousties's Building, Plot No. 1, 9th Floor, Sector 16A, Film City, Noida - 201301 | Tel. No.: 0120 4751818

Website: www.quintdigitalmedia.com | Email: cs@thequint.com EXTRACT OF UNAUDITED FINANCIAL RESULTS FOR THE QUARTER ENDING JUNE 30, 2021

				(₹ in '000)
Sr. No.	Particulars	Quarter ending June 30, 2021	Previous Year ending March 31, 2021	Corresponding 3 months ending June 30, 2020
1	Total Income from Operations	63,939.20	65,582.34	31,046.20
2	Net Profit / (Loss) for the period (before Tax, Exceptional and/or Extraordinary items)	6,606.56	2,797.69	(35,595.94)
3	Net Profit / (Loss) for the period before tax (after Exceptional and/ or Extraordinary items)	6,606.56	2,797.69	(35,595.94)
4	Net Profit / (Loss) for the period after tax (after Exceptional and/ or Extraordinary items)	4,902.56	4,469.42	(35,642.80)
5	Total Comprehensive Income for the period [Comprising Profit/ (Loss) for the period (after tax) and Other Comprehensive Income (after tax)]	4,276.33	5,257.79	(35,642.14)
6	Equity Share Capital	219,508	219,508	20,000
7	Reserves (excluding Revaluation Reserve) as shown in the Audited Balance Sheet of the previous year*	-		91,117.55
8	Earnings Per Share 1) Basic : 2) Diluted :	0.19 0.19	0.24 0.23	(8.91) (8.91)

a) The above is an extract of unaudited financial results for the quarter ending June 30, 2021 filed with the BSE Limited under Regulation 33 of the SEBI (Listing and Other Disclosure Requirements) Regulations, 2015.

b) Full format of the Quarterly Financial Results are available on the websites of the BSE Limited (www.bseindia.com) and the Company (www.quintdigitalmedia.com). c) The above results are duly reviewed by the Audit Committee and have been approved by the Board of Directors in its meeting held on July 16, 2021.

As on March 31, 2021

Date: July 16, 2021

Place: New Delhi


For and on behalf of Board of Directors

Chairperson Din: 00063017

Parshotam Dass Agarwal

Ahmedabad

CIN: L74899DL1994PLC063609



Accordingly, the proposed resolution item no 3 in relation to "Re-appointment of M/s Sharp & Tannan, Chartered Accountants, Statutory Auditors of the Company and to fix their remuneration" set out in the Notice dated 24" June, 2021 convening the 7" AGM of the Company scheduled to be held on Friday, 23" July, 2021, is withdrawn and will not be transacted during the forthcoming AGM.

2021, is <u>winnarawn</u> and will not be transacted during the formcoming AGM. The Board of the Directors of the Company shall recommend the name of an audit firm who may be appointed as Statutory Auditors of the Company for approval of the Members at a subsequent general meeting. In accordance with the provisions of section 139(10) of the Companies Act, 2013, the existing auditors shall continue until the appointment of the new auditors.

This corrigendum to the Annual Report for the financial year ended 31st March 2021 shall form integral part of the AGM notice dated 24st June, 2021 Accordingly, Registrar and Share Transfer Agent, depositories concerned shareholders, agencies appointed for e-Voting, and other concerned authorities and persons are requested to take note of the above.

For Crompton Greaves Consumer Electricals Limited

Email: ucwl.investors@jkmail.com, Website: www.udaipurcement.cor Phone: +91-11-68201861-864

for the purpose of quorum under Section 103 of the Act.

provided by Central Depository Services (India) Limited (CDSL): (A) Remote e-voting: The remote e-voting period commences on Monday, 16th August 2021 (10.00 A.M.) and ends on

made available at the AGM to those Members who have not A person whose name is recorded in the Register of Members or in

The manner of remote e-voting and e-voting at the AGM by the

The Members who have already casted their vote by remote

Any person, who acquire Shares and becomes Member of the Company

to the Company at ucwl.investors@jkmail.com or RTA at admin@mcsregistrars.com mentioning the First/Sole Shareholder's name, Registered Folio Number, E-mail Address, self-attested copy of Permanent Account Number card, self-attested copy of address proof (Aadhar card/voter ID card/passport/utility bill) and contact number.

After due verification and if requested, the Company/ RTA will forward

Shree Digvijay Cement Company Limited

CIN: L26940GJ1944PLC000749 CEMENT Digvijaygram, Jamnagar - 361 140 (Gujarat) Email: investors.sdccl@digvijaycement.com Website: www.digvijaycement.com Phone 0288-2344272-75, Fax No. 0288-2344092

Pursuant to Regulation 29 read with the Regulation 47 of the SEBI (Listing Obligations and Disclosure Requirements) Regulations 2015, as amended from time to time. Notice is hereby given that a meeting of the Board of Directors of the Company will be held on Thursday, 29th July, 2021, inter-alia, to consider and approve the Unaudited Standalone & Consolidated Financial Results of the Company for the quarter ended 30th June, 2021.

This Notice is also available at Investors Section of the Company's website www.digvijaycement.com and on the Stock Exchanges website at www.bseindia.com and www.nseindia.com, where the shares of the Company are listed

For Shree Digvijay Cement Company Limited

Suresh Meher Place: Digvijaygram VP (Legal) & Company Secretary Date: 15th July, 2021

કોર્મ G એક્સપ્રેશન ઓક ઇન્ટરેસ્ટ માટે આમંત્રણ

	એક્સપ્રેશન ઓફ ઇન્ટરેસ્ટ માટે આમંત્રણ					
	(ઇન્સોલ્વેન્સી અને બેન્ક્રપ્ટરી (ઇન્સોલ્વેન્સી રે:					
	નિચમનો, ૨૦૧૬ ના નિચમન					
	संशंधित वि					
9.	કોર્પોરેટ દેવાદારનું નામ	अक्टंग केटगीन प्रार्थिट विभिटेड				
8	कोर्पोरेट देवाहारना संख्यापननी तारीज	\$4/04/\$004				
3	ઓથોરીટી જેના હેઠળ કોર્પોરેટ દેવાદાર સંસ્થાપિત / રજીસ્ટર્ડ છે.	સમદાવાદ અમદાવાદ				
8	કોર્પોરેટ ઓળખ નંબર / કોર્પોરેટ દેવાદારનો લીમીટેડ લાયેબીલીટી ઓળખ નંબર	U17110GJ2005PTC045566				
7	કોર્પોરેટ દેવાદારની રજીસ્ટર્ડ ઓફીસ અને મુખ્ય ઓફિસ (જો કોઇ હોય તો)નું સરનામું	નક્ષત્ર હાઇટ્સ – ૭૦૮, ટેલિફોન એક્સરેંજ સામે, ૧૫૦ ફુટ, રાજકોટ, ગુજરાત – ૩૬૦૦૦૫				
9	કોર્પોરેટ દેવાદારના ફડચાની શરૂઆતની તારીખ	14/03/2021				
	એક્સપ્રેશન ઓફ ઇન્ટરેસ્ટ માટે આમંત્રણની તારીખ	P505/P0/P0				
V	કોડની કલમ ૨૫(૨)(એચ) હેઠળ રીઝોલ્યુશન અરજદારોની પાત્રતા ઉપલબ્ધ છે. હોવી જોઈએ અને આઈબીસી ૨૦૧૬ ની કલમ	(એ) સંભવિત રેપ્રોલ્યુશન અરજીકર્તાની નેટવર્થ ઓછામાં ઓછી રૂા. ૫ કરોડની રુલ્એ હેલ્લા ગેરલાયક ન હોવો જોઈએ.				
	(બી) એક્સપ્રેશન ઓફ ઈન્ટરેસ્ટની સાથે રૂા. ૫ લાખ પ્લાન જમા કરાવતી વખતે રૂા. ૩૫ લાખ. વધુ	નની પરત મળવાપાત્ર કિપોઝીટ અને રેઝોલ્યુશન સ્પષ્ટીકરણ premladdha@yahoo.com,				
	cirp.bajrang@gmail.com પરથી ઈમેલ મોક્લવા	દ્વારા મેળવી શ કા શે				
÷	ક્લમ રહ્યો હેઠળ લાગુ પડતા ગેરલાયકાતના નિયમો ઉપલબ્ધ છે:	premladdha@yahoo.com, cirp.bajrang@gmail.com પર ઇ–મેઇલ મોકલવા હારા વિગતો મેળવી શકાશે				
90	એક્સપ્રેશન ઓફ ઇન્ટરેસ્ટ મેળવવાની છેલ્લી તારીખ	30/06/२०२१ (द्वितिय विदंशन)				
99	बाही श्ररी કरवानी तारीण	01/02/2021				
4.5	કામચલાઉ થાદી માટે વાંધાઓ જમા કરવાની છેલ્લી તારીખ	05/02/2054				
L	સંભવિત रेजोब्युशन અરુજદારોની अंतिभ याही পাरी કरવાની तारीખ	20/02/2023				
98	સંભવિત રેઝોલ્યુશન અરજદારોને માહીતી મેમોરેન્ડમ, ઇવેલ્યુએશન મેટ્રીક્સ અને રેઝોલ્યુશન પ્લાનો માટે વિનંતી જારી કરવાની તારીખ	04/06/2054				
94	રેઝોલ્યુશન પ્લાન, ઇવેલ્યુએશન મેટ્રીક્ષ, માહીતી મેમોરેન્ડમ અને અન્ય માહીતી માટે વિનંતી મેળવવાની પધ્ધતિ	વાચક રેઝોલ્યુશન અરજીકતાં સાથે આઈબીસી ૨૦૧૬ ના ક્લમ સ્ક(૨) પ્રમાણે અન્ડરટેકિંગ મેળવ્યા પછી આરએકઆરપી, ઇવેલ્યુએશન મેટ્રીક્ષ, માહિતી મેમોરેન્ડમ અને અન્ય માહિતી શેર કરવામાં આવશે.				
9.5	રેઝોલ્યુશન પ્લાનો જમા કરાવાની છેલ્લી તારીખ	39/06/2029				
	रेओब्युशन प्रोईशनंदाने रेओब्युशन प्दानी रूभा करवानी रीत	ઇલેક્ટ્રોનિક ફોર્મમાં premladdha@yahoo.com અથવા cirp.bajrang@gmail.com ઇન્-મેઇલ આઇડી પર અને હાર્ડ કોપી એક રીલબંધ કવરમાં સ્પીડ પોસ્ટ હારા				
96	મંજુરી માટે નિર્ણાયક સત્તાધિકારીને રેઝોલ્યુશન પ્લાન પ્રસ્તુત કરવાની અંદાજીત તારીખ	06/06/3034				
96	रेओस्युशन प्रोहेशनवन। नाम सने रक्षस्ट्रेशन नंभर	CA अभराष रामरतज सङ्घा Reg. No: IBBI/IPA-001/IP-P00060/2017-2018/10138				
50	नाम, सरनामुं अने छ-मेश ल	CA પ્રેમરાજ રામરતન લક્ષ સરનામું : ૩૦૪, અભિજિત–૩, પેન્ટાલૂનનો ઉપર, મીઠાખળી–લૉ ગાર્ડન રોડ, એલોસ્ત્રીજ, અમદાવાદ–૩૮૦૦૦૬ Reg. No: IBBI/IPA-001/IP-P00060/ 2017-2018/10138 E-mail: premladdha@yahoo.com				
54	रेजोब्युशन प्रोहेशनव साथे रोटेशब्यवहार माटे ઉपयोगमां लेवानुं सरनामुं अने घमेघल	સરનામું : ૩૦૪, અભિજિત–૩, પેન્ટાલૂનની ઉપર, મીઠાખળી–લૉ ગાર્ડન રોડ, એલીસબ્રીજ, અમદાવાદ–૩૮૦૦૦૬ Email: premladdha@yahoo.com				
66	વધુ વિગતો ખાતે અથવા તેમની પાસે ઉપલબ્ધ છે	E mail: premladdha@yahoo.com, clrp.bajrang@gmall.com				
63	होर्भे छ ना प्रक्षशननी तारीज	%00/00/00%				
		સહી/-				

अक्टंग डोटगीन प्रार्धवेट बिमिटेडना रेओस्युशन प्रोडेशनस

Reg. no. IBBI/IPA-001/IP-P00060/2017-18/10138

Advt. no.: RLBCAU/01/2021 Dated: 16.07.2021

Rani Lakshmi Bai Central Agricultural University, Jhansi

Short Vacancy Notification

Inrough advertisement no. RLBCAU/01/2021, applications from eligible Indian Nationals are invited for recruitment for the following posts.						
S. No.	Position	Level	Discipline	No. of vacancies		
1.	Comptroller	14	On Deputation	01- UR		
2.	Dean, Fisheries Sciences	14	Fishieries Sciences	01- UR		
3.	Dean, Veterinary & Animal Sciences	14	Veterinary Sciences	01- UR		
4.	Secretary to Vice Chancellor	11		01- UR		
5.	Assistant Engineer (Civil)	10	Civil Engineering	01- UR		
6.	Assistant Registrar (Legal)	10		01- UR		
7.	Junior Account Officer	08		02- UR		
8.	Private Secretary	08		01- UR		
9.	Personnel Assistant	06		02 UR, 02 OBC, 01 SC		
10.	Upper Division Clerk	04		01- UR		
11	Teaching Cum Research	Temporary	Animal Science	02- UR		

For more details viz. essential qualifications, category of reservation pay scale, application fee, application form and other instructions please visit University website www.rlbcau.ac.in. The closing date for receipt of application will be 16 August, 2021. However, in case of candidates residing and posted in remote areas (as per Govt. norms) the closing date will be 31 August, 2021.

Associate

Note: Walk-in-Interview for the post of Teaching-cum-Research Associate will be held on.... (date to be displayed at University website). e-mail:- registrar.rlbcau@gmail.com

सिव्परटय टेइनोलोञ्चस विभिटेड

CIN: L72200GJ1995PLC024465 CIN: L722UUGJ1995PLC024405 રજી.ઓફિસઃ રજો માળ, સેફોન બિલ્ડીંગ, પંચવદી સર્સવની બાજુમાં, આંબાવાડી અમદાવાદ-3cooos, (ગુજરાત) ● ટેલિ.:+e૧ ૦૦૯ ૪૦૦૨ ૨૦૦૦(૧/૨/૩/૪ વેબસાર્થટઃ www.silverlouch.com • Email:cs@silverlouch.com

<u>રહમી વાર્ષિક સામાન્ય સભાની નોટીસ</u>

આથી નોટીસ આપવામાં આવે છે કે સિલ્વરટથ ટેકનોલોજીસ લિમિટેડની ૨૭મી એજીએમ મંગળવા ઓગસ્ટ ૧૦, ૨૦૨૧ ના રોજ સવારે ૧૨:૩૦ કલાકે વિડિયો કોન્ફરન્સ (VC) / અન્ય ઓડીયો વિઝયુઅલર્ન (OAVM) દ્વારા એજીએમની નોટીસમાં જણાવેલ કાર્યો પાર પાડવા માટે યોજાશે. કંપનીએ વાર્ષિક અહેવાલ ૨૦૨૦-૧ અને એજીએમની નોટીસ, ક્રોપીરેટ અફેર્સ મંત્રાલય દ્વારા જારી કરાયેલા તેના પરિપત્ર તા. પ મે, ૨૦૨૦ ના તેના પરિપત્રો તા. ૮ એપ્રિલ, ૨૦૨૦, તા. ૧૩ એપ્રિલ, ૨૦૨૦, તા. ૧૩ જાન્યુઆરી, ૨૦૨૧ અને સેબીના પરિપત્ર તા. ૧૫ જાન્યુઆરી, ૨૦૨૧ ને ધ્યાનમાં રાખતા જે સભ્યોના ઈમેલ એડ્રેસ કંપની અને / અથવા હિપોઝીટરી અને / અથવા આરટીએ પાસે રજીસ્ટર્ડ છે તેમને શુક્રવાર, ૧૬ જુલાઈ, ૨૦૨૧ ના રોજ કંકત ઈલેક્ટ્રોનિક રીતે મોકલ્યા છે. વાર્ષિક અહેવાલ અને એજીએમની નોટીસ કંપનીની વેબસાઈટ www. silvertouch.com અને નેશનલ સ્ટોક એશ્વરેન્જ ઓફ ઈન્ડિયા હિ. (એનએસઈ) ઈમર્જની વેબસાઈટ www1.nseindia.com/emerge પર તથા CDSL ની વેબસાઈટ www.evotingindia.com પર પણ ઉપલબ

કંપની કાયદા, ૨૦૧૩ ની કલમ ૯૧ અને તે હેઠળ થડાયેલા લાગુ નિયમો અને સેબી (લિસ્ટીંગઓબ્લીગેશન અને ડિસ્કલોઝર રીક્વાયરમેન્ટસ) નિયમનો, ૨૦૧૫ (લિસ્ટીંગ રેગ્યુલેશન)ના નિયમને ૪૨ અન્વયે આ સાથે વધુમાં અહીં નોટીસ આપવામાં આવે છે કે ફાઈનલ ડિવિડન્ડના હેતુસર શુક્રવાર, ૩૦ જુલાઈ, ૨૦૨૧ ને રેકોર્ડ ડેટ નક્કી કરેલ છે.

કંપની કાયદા ૨૦૧૩ ની કલમ ૧૦૮ ના કંપની (વ્યવસ્થાપન અને પ્રસાશન) નિયમો, ૨૦૧૪ ના નિયમ ૨૦ સુધારા મુજબ અને લિસ્ટીંગ રેગ્યુલેશનના નિયમન ૪૪ સાથે વાંચીને તે અન્વયે, કંપની તેના સભ્યોને CDSL દ્વારા પુરી પડાયેલી ઈ-વોટીંગ પાઢિતિનો ઉપયોગ કરીને જજ્ઞાવેલ નોટીસમાં દર્શાવેલ તમામ ઠરાવો પર તેના મત આપવા માટેની સવલત આપી રહી છે. મતના અધિકારો સભ્યો પાસે ૩ ઓગસ્ટ, ૨૦૨૧ ના રોજની સ્થિતી મુજબ રહેલા શેર્સની સંખ્યાના આધારે પ્રમાશસર ગણાશે, કે જે કટઓક તારીખ છે. કંપની કાયદા, ૨૦૧૩ની જોગવાઈઓ અને

ત હઠળ વડાયલા ાનયમાં મુજબ જરૂરા ાવગતા નાચ મુજબ આપલ છે.	
૧. રીમોટ ઈ-વોટીંગ શરૂઆત થવાની	શનિવાર, ૭ ઓગસ્ટ, ૨૦૨૧ના
તારીખ અને સમય	સવારે ૯-૦૦ કલાકે
૨. રીમોટ ઈ-વોર્ટીંગ પૂર્ણ થવાની	સોમવાર, ૯ ઓગસ્ટ, ૨૦૨૧ના
તારીખ અને સમય	સાંજે ૫-૦૦ કલાકે
૩. ઈ-વોર્ટીંગ માટે હક્કદારનો હક્ક નક્કી કરવાની કટઓફ તારીખ	મંગળવાર, ૩ ઓગસ્ટ, ૨૦૨૧

૪. કંપનીએ એજીએમની નોટીસ ઈ-મેલ કર્યા પછી કંપનીના શેરો પ્રાપ્ત કરનાર અને કંપનીના સભ્ય બનના વ્યક્તિઓ અને જેમના નામ પર રજીસ્ટર ઓફ મેમ્બર/(ડિપોઝીટરીઓ દારા) સંબધિત લાભાર્થી માલિકોન નિવેદનમાં કટઓફ તારીખ હાજર છે તેઓ એજીએમની નોટીસમાં જણાવેલ પ્રક્રિયાને અનુસરી-

તેમના મતદાનના હક્કનો ઉપયોગ કરી શકશે. પ. ઈ-વોટીંગ પ્રક્રિયા માન્ય ગણાશે નહીં સોમવાર, ૦૯ ઓગસ્ટ, ૨૦૨૧ ના સાંજે પ-૦૦ વાગ્યા પછી. દ. એજીએમ દરમ્યાન ઈ-વોટીંગ સવલત ઉપલબ્ધ રહેશે, જે સભ્યોએ એજીએમ પહેલા ઈ-વોટીંગથી તેમના મત આપ્યા છે તેઓ VC/ OAVM થી એજીએમમાં હાજર રહી શકે છે. પરંતુ એજીએમ દરમ્યાન ફરીથી ઈ-વોટ

આપવા હક્કદાર ગણાશે નહિ. 9. શેર હોલ્ડરો / સભ્યોને ઈ-વોટીંગ સંબધિત કોઈપ**લ** પ્રશ્નો હોય તો તેઓ હેલ્પ સેક્શન હેઠળ www evotingindia.com ઉપલબ્ધ FAQ's અથવા તો helpdesk@cdslindia.com પર ઈ-મેલ મોકલી શકે છે તથા શ્રી રાકેશ દાલવી (૦૨૨-૨૩૫૮૫૪૨) નો સંપર્ક કરી શકે છે.

તારીખઃ ૧૭/૦૭/૨૦૨૧

બોર્ડ ઓફ ડિરેક્ટરના આદેશથી સિલ્વરટર ટેકનોલોજીસ લિમિટેક વતી, સહી/- **દિપેશ સોલંકી** કંપની સચિવ અને કમ્પલાયન્સ ઓફિસર મેમ્બરશીપ નંબર: AC\$42076

www.Intinfotech.com



A Larsen & Toubro **Group Company**

LARSEN & TOUBRO INFOTECH LIMITED

Registered Office: L&T House, Ballard Estate, Mumbai 400 001; Tel: (91 22) 6752 5656; Fax: (91 22) 6752 5893, E-mail: investor@Intinfotech.com; Website: www.Intinfotech.com, Corporate Identity Number: L72900MH1996PLC104693

EXTRACT OF UNAUDITED FINANCIAL RESULTS FOR THE QUARTER ENDED JUNE 30, 2021

₹ Million

		Consolidated		Standalone		
Particulars	Quarter ended 30 June 2021 (Unaudited)	Year ended 31 March 2021 (Audited)	Quarter ended 30 June 2020 (Unaudited)	Quarter ended 30 June 2021 (Unaudited)	Year ended 31 March 2021 (Audited)	Quarter ended 30 June 2020 (Unaudited)
Total income	35,841	126,442	30,150	34,142	117,873	28,295
Net profit before tax	6,721	25,882	5,589	7,409	23,910	5,301
Net profit after tax	4,968	19,382	4,164	5,758	17,874	3,970
Total comprehensive income	4,807	24,170	5,420	5,341	22,260	5,058
Equity share capital	175	175	174	175	175	174
Earnings Per Share (not annualized) (Face value of ₹ 1/- each)						
a) Basic (in ₹)	28.40	110.98	23.92	32.95	102.45	22.80
b) Diluted (in ₹)	28.27	110.26	23.74	32.80	101.79	22.63

Note:

- 1. The consolidated and the standalone financial results of the Company for the quarter ended June 30, 2021 have been subjected to limited review by the statutory auditors, reviewed by the Audit Committee of the Board and approved by the Board of Directors at its meeting held on July 15, 2021.
- 2. The above is an extract of the detailed format of the unaudited financial results filed with the Stock Exchanges under Regulation 33 of the SEBI (Listing and Other Disclosure Requirements) Regulations, 2015, as amended ("Listing Regulations"). The full format of the unaudited consolidated financial results and the unaudited standalone financial results for the quarter ended June 30, 2021 are available on the Stock Exchange's website of BSE (www.bseindia.com/corporates), NSE (www.nseindia.com/corporates) and Company's website at www.Intinfotech.com/investors.
- 3. The results for the quarter ended June 30, 2021 are in compliance with Indian Accounting Standards (Ind AS) as notified by the Ministry of Corporate Affairs.
- The Board of Directors at its meeting held on July 15, 2021, has declared a special dividend of ₹10/- per equity share (Face value ₹1/-) for the financial year 2021-22
- 5. Figures for the earlier periods have been regrouped, wherever necessary.

For LARSEN & TOUBRO INFOTECH LIMITED

Place: New Jersey, USA, Date: July 15, 2021

Sanjay Jalona Chief Executive Officer & Managing Director

B Reliance

Regd.office: 3rd Floor, Maker Chambers IV. 222, Nariman Point, Mumbai - 400 021, Phone: 022-3555 5000. Email: investor relat CIN: L17110MH1973PLC019786

NOTICE

NOTICE is hereby given that the following certificate(s) issued by the Company are stated to have been lost or misplaced and Registered Holders thereof have applied for the issue

Sr. No.	Folio No.	Name / Joint Names	Shares	Certificate Nos. From - To	Distinctive Nos. From - To
ı	65400065	Bibhuti Bhushan	25	16633429-429	466142745-769
			25	55170605-605	1341608333-357
			25	62726484-484	2226111661-685
			25	62819351-351	2232292301-325
			100	66908215-215	6896263332-431
2	107958218	Bibhuti Bhushan	18	58226491-491	1615181851-868
			18	62203229-229	2184822040-057
			36	66908292-292	6896268439-474
3	107413793	Chiter Lekha Anand	126	66440121-121	6856498051-176
4	11345948	Deepak Kukreja	124	66432044-044	6855674658-781
	115.57.10	Usha Kukreja		00.102011.011	
5	126483352	Devender Parsad Sharma	27	62268203-203	2190057922-948
_	12010002		54	66475061-061	6859203749-802
6	109132511	Devendera Prashad	18	61869455-455	2180792872-889
•	107132311	Sharma	36	66475055-055	6859203569-604
7	128438869	Devendra Parsad Sharma	9	61869467-467	2180793016-024
7.0			18	66475064-064	6859203983-000
8	68439591	Devendra Singh	50	62267809-809	2190031003-052
•	*******	Sunita Singh	100	66474493-493	6859164790-889
9	75830611	Dhirajlal Meghji Pattani	110	62480318-318	2209202819-928
•	75050011	Diningia Fregriji Facazii	220	66738928-928	6882889918-137
10	75530714	Harsh Vardhan Bhargava	30	16709675-676	467693225-254
	75550714	Tial Sil Val Clian Dilai gava	30	55177943-944	1342396898-927
			30	62689376-376	2225182281-310
			30	62764731-731	2227841448-477
п	9595503	Hasmukh Jamnadas Shah		5748708-708	118850009-208
	7373303	Malti Hasmukh Shah	50	7968595-595	158889913-962
		Maru Hasmukn Shan	50 50		
				12262747-747	253753756-805
			300 600	54812994-999	1328293950-249
				62649045-045	2220928399-998
			1200	66912573-573	6896967982-181
12	563960	Jayantilai Gokaldas	8 5	322912-912 647232-232	13636062-069 17420110-114
		Gandhi	76	823469-470	20312818-893
		Latadevi Jayantilal Gandhi	/6 		
		D 11 1 D1 1 1 1 1 7 1	100	1038978-978	25621588-598
13	24808009	Jivabhai Bhulabhai Zala		13059145-146	266844724-823
		14 LV47 LV	100	54221348-349	1279062498-597
14	22507231	Karamshi K Thakkar	50	11865333-333	219386385-434
			50	51121629-629	1170852278-327
15	102019523	Nand Kumar	18	62205699-699	2184858606-623
		Pushpa Mandal	36	66910868-868	6896442108-143
16	114001611	Naranbhai Kapupara	18	57664430-430	1598802673-690
			18	61923186-186	2181473806-823
			36	66535407-407	6863579473-508
17	117156462	Nawab Abdul Matin			*********
	34557046	Mohiuddin	90	66628358-358	6870859747-836
18	34557268	Patima Mohammed	18	7552362-363	147568957-974
		Abdul Aziz	148	62462529-529	2207752293-440
19	114001638	Pravinbhai Kapupara	63	57664432-432	1598802709-771
			63	62311845-845	2193231135-197
			126	66535409-409	6863579545-670
20	102019531	Pushpa Mandal	18	62205700-700	2184858624-641
		Nand Kumar	36	66910869-869	6896442144-179
	1		70	1 44400017 017	/0/000/377 //0

No.		6200		From -To	From -To
22	84954632	Rajeshree Pravin	38	59690320-321	84158607-64
		Bhanushali	15	59690322-322	136284502-51
			12	59690323-323	184917548-55
			65	59690324-324	6905858181-24
23	4573064	Rita Kapoor	5	20004400-400	136456750-75
			20	20142663-663	84374717-73
			5	20142664-664	17906764-76
			5	50558577-577	1160729497-50
			25	54957986-986	1335084132-15
			60	62211355-355	2185309300-35
24	84695718	Rohan Lasrado	318	68372611-611	6782088109-42
25	21767328	Sangeeta Goyal	38	5162053-05 4	84901253-29
			4	8948385-385	84688575-57
			97	13223969-970	290553538-63
			42	53449464-465	1250740956-99
			84	62591654-654	2217576294-37
			168	66876485-485	6894038057-22
26	58786136	Sangeeta Goyal	93	11793931-932	216352485-57
			93	53763122-124	1259814545-63
			186	62591674-674	2217577693-87
			372	66876502-502	6894039642-01
27	35153799	Sanjay Bhandari	274	62269278-278	2190143758-03
28	114001620	Shantaben Kapupara	18	57664431-431	1598802691-70
78	5525 31 10		18	61923187-187	2181473824-84
			36	66535408-408	6863579509-54
29	28470983	Shrikant Rameshbhai	20	3608034-034	55369979-99
		Patel	8	6974993-993	142910720-72
		Janak Rameshbhai Patel	10	10212160-160	183497128-13
		•	38	62628517-517	2219878550-58
30	68180139	Sri Kanth Punati	50	51137834-834	1171662528-57
		processions	50	56878324-324	390477800-84
			100	66773011-011	6885551785-86
31	73243637	Srikanth Punati	30	53046678-679	1243526560-58
			30	56878325-326	396345455-48
			60	66773036-036	6885555072-13
32	83565721	Sundari Ayyar	25	50201206-206	1157170173-19
		7077	25	59483064-064	387961000-02
			50	62419435-435	2203836128-17
			100	66668700-700	6876276647-74
33	55978042	Sunita Rungta	20	11511755-755	207663672-69
		•	20	55034390-390	1337606546-56
			40	62546422-422	2214067162-20
34	28847033	Usha Rani De	80	66884767-767	6894600626-70
		Asok De			
35	69187510	Vagatavarmal A Jain	25	14549789-789	389879650-67
			25	51060054-054	1168748203-22
			50	62555331-331	2214769694-74
			100	66831512-512	6890430200-29
36	31485321	Venkata Satyanarayana		Location en Si	sourceful that mile its
		Konakalla	50	10532416-416	188401791-84
			272	66792537-537	6886906519-79
37	20141018	Venkatesh R Civi	26	62462424-424	2207738292-31
			52	66717805-805	6881070784-83
38	34577161	Venkatesh R Civi	20	4453322-322	72275739-75
	andresia spektist		76	62462543-543	2207753842-91
			152	66717899-899	6881088189-34
39	125826744	Vîmla D Pahlajani	36	57647984-984	1598341461-49
			36	66517684-684	6862305194-22
_		Total	8611		
		LOTAL	60 I I		

Sr. Folio No. Name / Joint Names Shares Certificate Nos. Distinctive Nos.

with the Company's Registrar and Transfer Agents viz. "KFin Technologies Private Limited", Selenium Tower B, Plot No. 31-32, Gachilbowli, Financial District, Nanakranguda, Hyderabad - 500 032, within Seven (7) days from the date of publication of this notice, eed to issue duplicate certificate(s) in respect of the iling which, the Company will proc aforesaid securities.

for Reliance Industries Limited Savithri Parekh Joint Company Secretary and Compliance Officer

Date : July 16, 2021

Place : Mumbai

અદાણી હાઉસિંગ ફાચનાન્સ પ્રાઇવેટ લીમીટેડ adani

66608217-217 6869026377-448

Housing

113261687

Rajendra S Patel

રજીસ્ટર્ડ ઓફીસ : શિખર, મીઠાખળી સર્કલ પાસે, નવરંગપુરા, અમદાવાદ-૩૮૦૦૦૯, ગુજરાત, ભારત. **કોર્પેરેટ ઓફોસ** : વન બીકેસી, સી-વિંગ, ૧૦૦૪/૫, દસમો માળ, બાંદ્રા કુર્લા કોમ્પલેસ, બાંદ્રા (ઇસ્ટ), મુંબઇ-૪૦૦ ૦૫૧. મહારાષ્ટ્રા, ભારત. CIN: U65999GJ2017PTC098960, વેબસાઇટ : www.adaniho

સરફૈસી એક્ટ, ૨૦૦૨ ની કલમ ૧૩(૨) હેઠળ માંગણા નોટીસ તમો નીચે જણાવેલ દેવાદારો, સહ–દેવાદાર(રો)/ જમીનદારોએ સ્થાવર મિલકતો (સિક્ચોરીટીઝ)ના ગીરો દ્વારા અદાણી હાઉસિંગ ફાયનાન્સ પ્રાઇવેટ વીમીટેડ (એએચએ ફપીએલ) પાસેથી લોન/નો

સવલત(તો) મેળવી છે. તમારા કસુરોને પગલે તમારી લોનો નોન પરફર્મિંગ એસેટ તરીકે વર્ગીકૃત કારઇ હતી, અદાધી હાઉસિંગ ફાયનાન્સ પ્રાઇવેટ લીમીટેડે બાકી રકમની વસુલાત માટે સિક્ચોરીટાઇગ્રેશન અને રીકન્સ્ટક્શન ઓફ ફાયનાન્સિયલ એસેટ અને એન્ફોર્સમેન્ટ ઓફ સિક્ચોરીટી ઇન્ટરેસ્ટ એક્ટ ,૨૦૦૨ (એક્ટ) ની કલમ ૧૩ (૨) હેઠળ માંગણા નોટીસ જારી કરી હતી. જેની વિગતો સિક્યોરીટી ઇન્ટરેસ્ટ (એન્ફોર્સમેન્ટ) નિયમો, ૨૦૦૨ ના નિયમ ૩(૧)સાથે વંચાતી એક્ટની કલમ ૧૩(૨) હેઠળ અને તમને બજવણીના માર્ગે તરીકે પ્રકાશીત કરાઇ રહી છે. દેવાદારો, સહ-દેવાદારો, ગીરો મિલકતો, બાકી રકમ, કલમ ૧૩(૨) હેઠળ મોકલાચેલ માંગણા નોટીસની તારીખ, બાકી રકમની વિગતો નીચે આપેલ છે: દેવાદાર/સહ-દેવાદાર/જામીનદારનું ગીરો મિલકતનું સરનામું માંગણા નોટીસની

દવાદાર/સહ-દવાદાર/જામીનદારનુ નામ / લોન એકાઉન્ટ નંબર / જુનો લોન એકાઉન્ટ નંબર	ગીરી મિલકતનું સરનામું	માગણા નોટીસની તારીખ / બાકી રકમની તારીખ
સ્નેહલ પ્રવિણચંદ્ર શેઠ ક્રામિની સ્નેહલ શેઠ ABDAHL00009636	ફ્લેટ નં. ૨૩, ૩જોમાળ, આનંદધારા એપાર્ટમેન્ટ સેશીલ કો.ઓપ.હાઉસિંગ સોસાયટી લીમીટેક તરીકે જાણીતી સ્કીમમાં, ગ્રામ પંચાયત હાઉસ નં. ૧૨૯ થી ૧૩૨ પૈકી, સીટી સર્વે નં.૧૦૪૮/૧/૨, મોજે મેમનગર, તાલુકો– ઘાટલોડિયા, જિલો– પેટા જિલો– અમદાવાદ ખાતેની સ્થાવર મિલકતના તમામ ભાગ અને હિસ્સા. (ક્ષેત્રફળ અંદાજીત દ્દદ.૮૯ ચો.ચાર્ક) ચતુઃસીમા : પુર્વ : ખુલી જગ્યા, પશ્ચિમ : પેસેજ અને સીડીઓ, ઉત્તર : ફ્લેટ નં. ૨૨, દક્ષિણ : ખુલી જગ્યા	૦૯−૦૭−૨૧ રૂા. ૨૩૯૩૬૬૧/− ૩૦−૦૬−૨૧ મુજબ
દિનેશભાઇ દલાભાઇ સવલ નિતાબેન દિનેશભાઇ સવલ કમલ ભીમસેન મનચંદા 8000HL001018305 GDHAHL000010032	પ્લોટનં. ૧૭/બી, (મેઇન પ્લોટ ૧૭ નો સબ પ્લોટ), ગાયત્રી હોમ્સ રેસીડેન્સી, રેવન્યુ સર્વે નં. ૨૫૪/૧ પૈકી–૧, જમીનનો એરિયા ક્ષેત્રફળ ૪૫.૫૦ ચો.મી., ગામ વરસામેડી, તાલુકો– અંજાર, જિલો–કચ્છ ખાતેના હઉસની મિલકતના તમામ ભાગ અને હિસ્સા. ચતુઃસીમા : પુર્વ : કોમન પ્લોટ, પશ્ચિમ : ૭.૫૦ મીટરનો પહોળો રોડ, ઉત્તર : સબ પ્લોટ નં. ૧૭/એ, દક્ષિણ : સબ પ્લોટ નં. ૧૬/એ	૦૯–૦૭–૨૧ રૂા. ૮૪૧૦૧૮/– ૨૯–૦૬–૨૧ મુજબ
મુકેશ મુળજી મહેશરી સોનબાઇ મુળજીભાઇ સુંઢા 8000HL001018612 GDHAHL000010018	સબ પ્લોટ નં. ૫૧-બી, પૂર્વ પાર્ટ, મેઇન પ્લોટ-૫૧, પ્લોટ એરિયા ૪૩.૮૨ ચો.મી., સર્વે નં. ૨૫૪/૧/પૈકી ૧ ગાયત્રી હોમ રેસીકેન્સી, ગામ વરસામેકી, તાલુકો– અંજાર જિલો–કચ્છ ખાતેના રેસીકેન્સીયલ એન.એ. પ્લોટની જ્મીનના તમામ ભાગ અને હિસ્સા. ચતુઃસીમા : પૂર્વ : લાગુ સર્વે નં. ૨૫૪/૨, પશ્ચિમ : સબ પ્લોટ નં. ૫૧/એ, ઉત્તર : ૭.૫૦ મીટર પહોળો રોડ, દક્ષિણ : પ્લોટ નં. ૫૮/બી	૦૯-૦૭-૨૧ રૂા. ૮૩૮૦૦૯/- ૨૯-૦૬-૨૧ મુજબ
વિજય નરશીભાઇ સથવાસ પ્રેચા વિજય સથવાસ 8000HL001018591 GDHAHL000010013	સબ પ્લોટ નં. ૧– એ, મેઇન પ્લોટ નં. ૧, પ્લોટ એરિયા અંદાજીત ૮૪.૮૬ ચો.મી., સર્વે નં. ૨૫૪/૧/પૈકી ૧ ગામ– વરસામેડી, તાલુકો– અંજાર, જિલો–કરછ ખાતેની રેસીડેન્સીયલ હેતુસરના એન.એ. પ્લોટની જમીનના તમામ ભાગ અને હિસ્સા. ચતુઃસીમા : પુર્વ : કોમન રોડ, પશ્ચિમ : ૭.૫૦ મીટરનો પહોળો રોડ, ઉત્તર : ૯.૦૦ મીટર પહોળો રોડ, દક્ષિણ : સબ પ્લોટ નં. ૧/બી	૦૯–૦૭–૨૧ રૂા. ૧૪૬૮૩૪૧/– ૨૯–૦૬–૨૧ મુજબ
મચુરભાઇ વસરામભાઇ ગાચર ઉષાબેન મચુર ગાચર 8000HL001016457	રેસીકેન્સીચલ ખુલા પ્લોટ નં.૫૦/૩, ક્ષેત્રફળ ૫૪.૬૦ ચો.મી, રેવન્યુ સર્વે નં. ૨૧/પૈકી ૨, ગામ દારેકનો, જેજામનગર એરિયા કેવલોપમન્ટ ઓચોરીટી અને ક્લેક્ટર જામનગરના હુકમચી બિન ખેતીલાયક રેસીકેન્સીયલ પ્લોટમાં ફેરવાઇ હતી. તે જમીનના તમામ ભાગ અને હિસ્સા. યતુ:સીમા: પુર્વ : રોક, પશ્ચિમ : પ્લોટ નં. ૩૬+૩૭, ઉત્તર : સબ પ્લોટ નં. ૫૦/૪, દક્ષિણ :	૦૯−૦૭−૨૧ રૂા. ૭૧૧૨૪૨/− ૨૯−૦૬−૨૧
JAMAHL000010230 દ્રાજસિંહભાઇ કાનાભાઇ કંદોરીચા ડાઇબેન વરશીભાઇ કંદોરીચા	સબ પ્લોટ નં. ૫૦/ર ક્લેટ નં. ૫૦૧, શ્રી હરી વલભ ટાવર –૧, ક્ષેત્ર ફળ બિલ્ટ અપ એરિયા ૭૭.૩૫ ચો.મી., સુપર બિલ્ટ અપ એરિયા ૧૧૮.૪૫ ચો.મી., સર્વે નં. ૩૨ પૈકી, પ્લોટ નં. ૧૦૭, સબ પ્લોટ નં. ૧૦૭/૧ ચી ૧૦૭/૪, પૈકી પ્લોટ નં. ૧૦૭/૧, ટાઉન પ્લાનિંગ સ્કીમ નં.ર, સીટી	મુજબ ૦૯–૦૭–૨૧ રૂા. ૫૬૩૮૬ <i>૭/</i> –
800HL001018579 JAMAHL000010232 ખીમાભાઇ પી. ચાવડા જીવીબેન ખીમાભાઇ ચાવડા	સર્વે નં. દુદ્દવ, શીટ નં. ૩૮૭, વોર્ડ નં. ૧૫, જામનગર મ્યુન્સિપલ કોર્પોરેશન ખાતેની સ્થાવર મિલકતના તમામ ભાગ અને હિસ્સા. ચતુઃસીમા : પુર્વ : રોડ, પશ્ચિમ : કોમન પેસેજઅને ફ્લેટ નં. ૫૦૪, ઉત્તર : પ્લોટ નં. ૫૦૨, દક્ષિણ : પ્લોટ નં. ૧૦૭/૨/પૈકી ફ્લેટ નં. ૧૦૨, શ્રી રાજહાઇટ્સ, ક્ષેત્રફળ બિલ્ટ અપ એરિયા ૩૫.૧૬ શ્રો.મી. અને સુપર બિલ્ટ અપ એરિયા ૭૦.૭૦ શ્રો.મી., શ્રી રાજહાઇટ્સ તરીકે જાણીતી બિલ્ડીંગ, પ્લોટ નં. ૮૩ ક્ષેત્રફળ ૧૫૪.૭૬ શ્રો.મી. ૫૨ બંધાચેલ, સરદાર પાર્કની, જામનગર એરિયા	૨૯−૦૬−૨૧ મુજબ ૦૯−૦૭−૨૧ રૂા. ૧૫૬૯૨૧૫/−
	ડેવલોપમેન્ટ ઓથોરીટી, જામનગર શહેરની મંજુદીથી, રાયછાત સાગર રોડ, ક્ષેત્રફળ ૧૯૮૨૯.૦૦ સો.મી.ના એરિયામાંથી જામનગર એરિયા ડેવલોપમેન્ટ ઓથોરીટી અને જિલા પંચાયત જામનગરના હુકમથી સરદાર પાર્ક તરીકે જાણીતા ૧ થી ૧૦૫ બિન ખેતીલાયક રેસીકેન્સીયલ પ્લોટમાં ફેરવાયા હતા. તે ખાતેની જમીનના તમામ ભાગ અને હિસ્સા. યતુ:સીમા : પૂર્વ :પ્લોટ	૩૦-૦૬-૨૧ મુજબ
JAMAHL000010213 કેતન દેવકરણભાઇ ગોહેલ ભાવનાબેન કેતનભાઇ ગોહેલ રિતેષભાઇ સામજીભાઇ વસોચા 8010HL001016862 RAJAHL000010774	નં. ૮૨, પશ્ચિમ: કોમન પેસેજઅને ફ્લેટ નં. ૧૦૧, ઉત્તર: ઓટીએસ, દક્ષિણ: કોમન પેસેજઅને પ્લોટ નં. ૮૪ આવકાર રેસીડેન્સી તરીકે જાણીતો એરિયા, વૃંદાવન પાર્ક-૪, રેવન્યુ સર્વે નં. ૩૮૩ પૈકી ૩, ગોંડલ, જિલો - રાજકોટ પ્લોટ નં. ૧૧ ખાતેની એન.એ. જમીન પર ક્ષેત્રફળ ૭૫-૯૦ સો.મી. માં બંધાયેલ રેસીડેન્સીયલ ટેનામેન્ટનો હિસ્સો બનતી સ્થાવર મિલકતના તમામ ભાગ અને હિસ્સા. ચતુઃસીમા : પૂર્વ : ૭.૫૦ મીટરનો રોડ, પશ્ચિમ: રેવન્યુ સર્વે નં. ૩૮૩ પૈકી ખેતીલાયક જમીન, ઉત્તર: પ્લોટ નં. ૧૦, દક્ષિણ: પ્લોટ નં. ૧૨	૦૯–૦૭–૨૧ રૂા. ૨૧૮૬૬૯૧/– ૨૯–૦૬–૨૧ મુજબ
અમૃતપાલસિંઘ જશીન્દરસિંઘ રેનું જસવિન્દરકૌર કૌર રેનુ	ક્લેટ નં. ૩૦૨, ત્રીજો માળ, કાલિકા એપાર્ટમેન્ટ તરીકે જાણીતી બિલ્ડીંગમાં, મોજે કાડોદરા, બ્લોક નં.–૨૨૧ પૈકી, પ્લોટ નં. ૪૦, મહાદેવનગર તરીકે જાણીતી સોસાયટીમાં, ગામ–કાડોદરા, તાલુકો– પલસાણા, જિલો–સુરત, ક્ષેત્રફળ અંદાજીત પદ્દ૭.૦૦ ચો.ક્રુટ એટલે કે પર.દ્દદ ચો.મી. (કાર્પેટ એરિયા) ૯૫૪.૦૦ ચો. ફ્રુટ, એટલે કે ૮૭.૮૨ ચો.મી. (સુપર બિલ્ટ અપ એરિયા) તેમજ આ જમીનમાં ન વહેચાયેલ હિસ્સો ક્ષેત્રફળ ૮.૦૦ ચો.મી. ધરાવતી સ્થાવર મિલકતના તમામ ભાગ અને	૦૯–૦૭–૨૧ રૂા. ૧૦૮૨૪૩૬/– ૨૯–૦૬–૨૧ મુજબ
8010HL001020101 SURAHL000011018 ભગવતીપ્રસાદ શ્રીરામ પાંડે	હિસ્સા. ચતુઃસીમા : પુર્વ : પ્લોટ નં. ૩૯, પશ્ચિમ : પ્લોટ નં. ૪૧, ઉત્તર : ફ્લેટ નં. ૪૦૨, દક્ષિ ણ : ૨૦ ફુટનો રોડ ફ્લેટ નં. ૧૦૬, પેહલો માળ, માઁ શારદા પેલેસ– હલદાારૂ , રેવન્ચ્ સર્વે નં. ૩૫૨, જૂનો બ્લોક નં. ૪૪૬, રેવન્ચ્ સર્વે પછી બ્લોક	06-00-5d
มิม ดแวเสส นเร้ 8010HL001016486 SURAHL000033205	નાં.૪૯૦/એ અને ૪૯૦/બી, જોડાણ પછી નવો બ્લોક નં. ૪૯૦/એ પૈકી, પ્લોટ નં. ૧૨૫/એ, ૧૨૫/બી, ૧૨૬ અને ૧૨૭, શુભમ રેસીડેન્સી તરીકે જાણીતી સોસાચટી, ગામ–હલદારૂ, તાુલકો– કામરેજ, જિલો– સુરત, ક્ષેત્રફળ અંદાજીત ૫૫૫.૦૦ ચો.ફ્રુટ, એટલે કે ૫૧.૫૭ ચો.મી., (સુપર બિલ્ટ અપ એરિચા) અને ૩૦૯.૦૦ ચો.ક્રુટ એટલે કે ૨૮.૭૦ ચો.મી., (બિલ્ટ અપ એરિચા) તેમજ જમીનમાં ન લહેચાચેલ હિસ્સો ક્ષેત્રફળ ૮.૭૨ ચો.મી. ચતુઃસીમા : પૂર્વ : એન્ટ્રી અને પેસેજ, પશ્ચિમ : એપાર્ટમેન્ટનું માર્જીન, ઉત્તર : સીડીઓ અને ફ્લેટ નં. ૧૦૧, દક્ષિણ : ફ્લેટ નં. ૧૦૫	રા. ફડ૩૨૪૧/− ૨૯−૦૬−૨૧ મુજબ
જિતેન્દ્ર સદાનંદ પ્રધાન સદાનંદ શોભા પ્રધાન	ફલેટ નં. ર૦૫, બીજો માળ, બિલ્ડીંગ નં. ડી, મારૂતિ રેસીડેન્સી તીરકે જાણીતી, કાડોદરા, રેવન્યુ સર્વે નં. ૧૦૨/૧ અને ૧૦૨/૨, ૦લોક નં. ૧૦૪ અને ૧૦૫ પૈકી, પ્લોટ નં. ૪૬ થી ૪૯, શ્રિવમ રેસીડેન્સી તરીકે જાણીતી, ગામ–કાડોદરા, તાલુકો– પલસાણા, જિલો–સુરત ક્ષેત્રફળ અંદાજીત ૮૯૦.૦૦ ચો.ક્કુટ (સુપર બિલ્ટ અપ એરિયા) અને ૪૧.૩૪ ચો.મી. (બિલ્ટ અપ એરિયા) તેમજ આ જ્યીનમાં ન વહેંચાયેલ હિસ્સો ક્ષેત્રફળ અંદાજીત ૮.૫૭ ચો.મી. ધરાવતી સ્થાવર મિલકતના તમામ ભાગ અને હિસ્સા.	૦૯–૦૭–૨૧ રૂા. ૯૭૪૩૮૫/– ૨૯–૦૬–૨૧ મુજબ
8010HL001018421 SURAHL000033228 มณุ ตเต	ચતુઃસીમા ઃ પુર્વ ઃ પ્રવેશ , પશ્ચિમ ઃ પાર્કીગ, ઉત્તર ઃ શોપ નં. ૨, દક્ષિણ ઃ સોસાયટીનો રોડ શોપ નં. ૨, ગ્રાઉન્ડ ક્લોર, બિલ્ડીંગ નં. એ, સિદ્ધેશ્વર રેસીડેન્સી તરીકે જાણીતી, બાગુમારા, રેવન્યુ સર્વે નં. ૭૧, બ્લોક નં.	oe-o <i>9</i> - २ ٩
રેખાં દેવી	૯૧ પૈકી પ્લોટ નં. ૧૦૦ થી ૧૦૨, બંસી પાર્ક તરીકે જાણીતી સોસાયટીમાં, ગામ: બાગુમારા, તાલુકો- પલસાણા, જિલો- સુરત, ક્ષેત્રફળ અંદાજીત ૩૯૪.૦૦ ચો.ક્ષુટ એટલે કે ૩૬.૬૧ ચો.મી., (સુપર બિલ્ટ અપ એરિયા) અને ૨૧૩.૦૦ ચો.ક્ષુટ ૧૯.૭૯ ચો.મી., (બિલ્ટ અપ એરિયા) તેમજ જ્મીનમાં ન વહેંચાયેલ હિસ્સો ધરાવતી સ્થાવર મિલકતના તમામ ભાગ અને હિસ્સા. યત્:સીમા	३१. ५५३६०७/- (७५२३६६+२०१२ ३१)
801LAP001029242 & 801LAP001028756 다음대속제국 어디어(대대 취미 요)라이라이 다음대 유기 가 카르	: યુર્વ : રોડ, પશ્ચિમ : પાર્કિંગ, ઉત્તર : શોપ નં. ૩, દક્ષિણ : શોપ નં. ૧ ફ્લેટ નં.૨૦૩, બીજો માળ, આધ્યશક્તિ દેસીડેન્સી તરીકે જાણીતી બિલ્ડીંગમાં, સાચણ, બ્લોક નં. ૩૯૪/સી પૈકી પ્લોટ નં.	२६-०६-२१ भुक्प ०६-०७-२१
કમલેશદેવી વકિલકુમાર સૈન સુરેશચંદ્ર બાબુલાલ નાપીત 8010HL001016432	93 થી ૧૫, ગામ—સાચણ, તાલુકો– ઓલપાડ, જિલો– સુરત ક્ષેત્રફળ અંદાજીત ૬૧૪.૭૮ ચો.ફ્રુટ એટલે કે ૫૭.૧૩ ચો.મી. (બિલ્ટ અપ એરિયા) અને ૮૯૧.૪૪ ચો.ફ્રુટ એટલે કે ૮૨.૮૪ ચો.મી. (સુપર બિલ્ટ અપ એરિયા) તેમજજમીનમાં ન વહેંચાયેલ હિસ્સો ધરાવતી સ્થાવર મિલકતના તમામ ભાગ અને હિસ્સા.	રૂા. ૧૧૪૬૪ <i>૭૮ -</i> ૨૯–૦૬–૨૧ મુજબ
SURAHL000011059 આકાશ ઓમપ્રકાશ સિંઘ	ચતુ:સીમા : પૂર્વ : પ્રવેશ અને પેસેજ, પશ્ચિમ : એપાર્ટમેન્ટનું માર્જીન, ઉત્તર : એપાર્ટમેન્ટનું માર્જીન, દક્ષિણ : ફ્લેટ નં. ૨૦૨ ફ્લેટ નં. ૧૦૩, પહેલો માળ, બિલ્કીંગ નં. ૧૧, શ્રી તિરૂપતિ બાલાજી રેસીડેન્સી તરીકે જાણીતી, સાંકી, બ્લોક નં. ૭૨/બી પૈકી	o૯-o૭- ૨ ૧
સાતા આવા સાર ચેતન બાલુ પાટિલ	બી ટાઇપ, પ્લોટ નં. ર૪ થી ૨૫, ગામ– સાંકી, તાલુકો– પલસાણા, જિલો– સુરત, ક્ષેત્રફળ અંદાજીત દ્રે ૩૧,૪૦ ચો.કુંટ (સુપર બિલ્ટ અપ એરિયા) અને ૩૧૫.૭૦ ચો.કુટ એટલે કે ૨૯.૩૪ ચો.મી. (બિલ્ટ અપ એરિયા) તેમજ આ જ્મીનમાં ન વહેચાચેલ હિસ્સો ક્ષેત્રફળ અંદાજીત દૃ.દૃ૦ ચો.મી. ધરાવતી સ્થાવર મિલકતના તમામ ભાગ અને હિસ્સા. ચતુઃસીમા : પુર્વ : સોસાયટીનો	રા. ૧૦૯૯૩૩૪/– ૩૦–૦૬–૨૧ મુજબ
SURAHL000011033	અંદરનો રોડ, પશ્ચિમ : પેસેજ/સીડીઓ, ઉત્તર : ફ્લેટ નં. ૧૦૪, દક્ષિણ : ફ્લેટ નં. ૧૦૨	-

8010HL001015078 SURAHL000011092 ઉત્તર : સોસાયટીનો રોડ, દક્ષિણ : બિલ્ડીંગ નં. બી મો દેવાદાર/રો અને સહ-દેવાદારો/ જામીનદારોને આથી આ નોટીસ મળઅચાની તારીખથી ૬૦ દિવસની અંદર ઉપર જ્યાવેલ માંગણાની બાકી રકમ તેમજસડત વ્યાજની ચુકવણી કરવા જ્યાવામાં આતે છે, જેમાં નિષ્ફળ જતાં, નીચે સહી કરનારને ઉપર જણાવેલ સિક્ચરીદીઝને ટાંચમા લેવા માટે એક્ટ હેઠળ પગલાં લેવાની ફરજપડશે. એક્ટની કલમ ૧૩ની પેટા કલમ (૮) ની જોગવાઇઓ પ્રતાચે તમારૂ ધ્યાને દોરવામાં આવે છે જેના ઉપયોગથી તમે સદરહું જોવાઇઓમાં જણાવેલ સમયગાળા દરમિયાન સિક્યોર્ડ એસેટ પરત મેળવવા માટે મુક્ત છો. નોંધ લેવી કે જણાવેલ એક્ટની ક્લમ ૧૩ (૧૩) હેઠળ, અમારી આગોતરી મંજુરી વગર, ઉપર જણાવેલ સિક્ચોરીટીઝની વેચાણ, લીઝ અથવા અન્ય રીતે તબદીલી કરવાની તમોને મનાઇ ફ્રૅરમાવામાં આવે છે

ફ્લેટ નં. એ/૧૦૬, પહેલો માળ, બિલ્ડીંગ નં. એ, ગોપીનાથ રેસીડેન્સી તરીકે જાણીતી, જોલ્વા, બ્લોક નં. ૨૪૭, પ્લોટ નં. ૩૬૯

થી ૩૦૯ (રેવન્યુ રેકોર્ડ મુજબ ૨૪૦/૩૬૯, ૨૪૦/૩૦૦, ૨૪૦/૩૦૧, ૨૪૦/૩૦૨, ૨૪૦/૩૦૩, ૨૪૦/૩૦૪, ૨૪૦/૩૦૫, ૨૪૦/૩૦૬,

૨૪૭/૩૭૭,૨૪૭/૩૭૮,૨૪૭/૩૭૯),આરાધના ગ્રીનલેન્ડ તરીકે જાણીતી સોસાયટી,ગામ– જોલ્વા,તાલુકો–પલસાણા, જિલો–

સુરત, ક્ષેત્રફળ અંદાજીત ૫૫૭.૦૦ ચો.ફુટ (સુપર બિલ્ટ અપ એરિયા) અને ૩૩૪.૦૦ ચો.ફુટ એટલે કે ૩૧.૦૨ ચો.મી., (બિલ્ટ

એપ એરિયા) ધરાવતી સ્થાવર મિલકતના તમામ ભાગ અને હિસ્સા. **ચતુઃસીમા : પુર્વ :** સોસાયટીનો રોડ, **પશ્ચિમ** :સી.ઓ.પી.,

9-00-99

31.030960/-

06-09-64

મુજબ

અંદરનો રોડ, **પશ્ચિમ** : પેસેજ/સીડીઓ, ઉત્ત**ર** : ફ્લેટ નં. ૧૦૪, **દક્ષિણ** : ફ્લેટ નં. ૧૦૨

સ્થળ : ગુજરાત તારીખ : ૧૭.૦૭.૨૦૨૧ અદાણી હાઉસિંગ ફાયનાન્સ પ્રાઇવેટ લીમીટેક વતી 🛨 ભાષાંતરમાં ત્રુટી અથવા વિસંગતતા હશે તો અંગ્રેજી સંસ્કરણ માન્ય રહેશે. અધિકૃત અધિકારી

Adfactors 150

SURAHL000011033

ફુલરામ પુન્માસમ પુરોહિત પાચુદેવી માલાસમ